સોના-ચાંદીના વાયદાના ભાવમાં ચાલુ રહેલો તેજીનો પવન : ક્રૂડ તેલમાં નરમાઈ

ટનમાં ૩૨,૧૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા



નથી.અમે આપેલા સૂચનો ઉપર રીતે સૂનિશ્ચિતઅને સુદ્રઢ કરવાની

થાય છે.

દેશના અનેક...

તેવું લાગતું નથી સરકાર પગલાં નથી વેપાર, કાળા બજાર કરનારને ફાયદો

કોરોના ની લહેર ઓછી થઈ છે માટે સીલીન્ડર રીફીલ કરાય છે, ત્યાંના

રેમદેસીવીરનું ઉત્પાદન ઘટાડવામાં વડાએ કહ્યુ હતુ કે મારે ૨૦ વધારાના

જરૂરિયાત નહોતી. તકેદારીની હજી કહેવુ છે કે વેન્ડરે મને કહ્યુ છે કે મારે

પણ જરૂરિયાત છે.તો કોર્ટે કહ્યું કે કેન્દ્ર સિલીન્ડર માટે વધુ પૈસા આપવા પડે સરકારે વારંવાર રાજ્ય સરકારોને છે તેથી હું વધુ લઉ છું.તેઓએ કહ્યુ હતુ

રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને માત્ર ૨૦ દિવસનો જ ઓકિસજન

હોય એમ લોકો બચી જશે તે પ્રકારની લખનઉને ગાઝીયાબાદથી ઓકિસજન

વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે મળવાનુ શરૂ થયુ છે. ઓકિસજન

તમારે ઓપન લેટર જાહેર કરવો વેચતા લોકોનું કહેવુ છે કે ઘરોમાં

જોઈએ અને રેમદેસીવીર થી શરીરમાં ઓકિસજનના સહારે રહેતા દર્દીઓ

થતી આડઅસરો વિશે પણ જાણ કરવી માટે ઓકિસજન કન્સરડેટર ઘણુ

જોઈએ.તે પણ ટકોર આજે કોર્ટ ઘ્વારા મદદરૂપ થયા છે તે ભાડે પણ મળે

મુંબઈ, તા.૧૫ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૪૫૨૧૧ સોદામાં રૂ.૯૮૧૧.૧૨ કરોડનું ટર્નઓવર રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં કોટનમાં ૩૨,૧૨૫ ગાંસડીના સોના-ચાંદીના વાયદાના ભાવમાં વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા તેજીનો પવન ચાલુ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. કોટનમાં ઓપન વધ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ઈન્ટરેસ્ટ ૨,૩૦,૦૦૦ ગાંસડીના ગ્રામદીઠ રૂ.૩૭૩૨૪ અને ગોલ્ડ-

પહેલા પાનનું અનુસંઘાન

રાજ્ય સરકારે ઠોસ પગલાં લીધા હોય

લઈ રહી એવું અમે નથી કહેતા.પણ

જે રીતે પગલાં લેવા જોઈએ, જે ધક્કો

આપીને કામ થવું જોઈએ એ થયું નથ

એડવોકેટ જનરલે કહ્યું. માત્ર સરકાર

જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે

આવ્યું એડવોકેટ જનરલે સ્વીકાર્યું કે

અમારે વધુ આત્મવિશ્વાસમાં રહેવાની

સૂચનાઓ આપી છે કે તકેદારી

રાખવાની જરૂરિયાત છે, બીજી લહેર

આવશે. આજથી એમ્બ્યુલન્સ માટેની

વ્યવસ્થા સુદ્રઢ કરાશે. નવી એસ.

ઓ.પી. લાગુ કરાશે તેવું પણ કોર્ટે

કહ્યું હતું. એફિડેવિટમા ક્યાંય પણ

આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું

નથી. આ લઈ લેશે તો અમૃત લીધું

કોરોનાના નિયંત્રણમાં...

વાયદો કિલોદીઠ રૂ.૩૩૫ વધ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં નરમાઈ વાયદાના ભાવમાં ગ્રામદીઠ રૂ.૨૪૯ અને ચાંદીનો સ્તરે રહ્યો હતો. કપાસ, સીપીઓ,

છે એ બરાબર છે. પરંતુ આપની પાસે

પૂરી મશીનરી છે આપે વસ્તુઓ યોગ્ય

જરૂર છે આના કારણે ઇન્જેક્શનનો

ત્યાં સુધી મને વધારાના પૈસા

ચુકવવામાં વાંધો નથી. મલાડ

સીલીન્ડર માટે ૬૦,૦૦૦ રૂ. ડીપોઝીટ

આપવી પડી હતી. હોસ્પીટલના હેડનું

કે કેટલીક હોસ્પીટલોએ સીંગલ ઝમ્બો

સીલીન્ડરના રીફીલીંગ માટે ૨૫૦૦

રૂ. પણ આપ્યા છે, જ્યારે નાની

હોસ્પીટલોએ રીફીલીંગ માટે સંઘર્ષ

કરવો પડી રહ્યો છે.કોરોનાના વધતા

કેસ વચ્ચે નવી મુંબઈ મનપા પાસે

કોના સુપરવિઝનમાં આપવી તે બાબતે છે તો યુપીના અનેક જિલ્લાઓમાં વધી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં ગઈ

ઓકિસજનની અછત જોવા મળી રહી

છે. લખનઉમાં પણ આ જ સ્થિતિ છે.

વાયદાઓમાં કુલ ૭૭૧૩૧ નો ભાવ રહ્યા હતા. સોદાઓમાં રૂ.૪૧૬૬.૮૨ કરોડનાં વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૬૮૦ વધીને રૂ.૪૬૮૫૭ બંધ રહૃાો હતો. સત્રનાં અંતે રૂ.૧૧૬ વધીને ૮ બંધરહૃાા હતા. પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં કુલ ૪૩૯૩૩

મેળે ઓકિસજન લાવવા જણાવાય છે.

ભોપાલમાં ઓકિસજન સિલીન્ડર સાથે

લાવો કે બીજી હોસ્પીટલમાં દાખલ થઈ

જાવ તેવુ કહેવામાં આવે છે. ઝારખંડમાં

પણ ઓકિસજનની અછત જોવા મળી

રહી છે ત્યાં ટાસ્કકોર્સ રચવામાં આવી

કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,

તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત,

રાજસ્થાન અને કેરળમાં રોજેરોજ

રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે. સ્વાસ્થ્ય

વિભાગ તરફથી જાહેર કરવામાં

આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮,૯૫૨ લોકો

કોરોનાથી સંક્રમિત થયા છે અને ૨૭૮

દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલા

મંગળવારે રાજ્યમાં ૬૦૨૧૨, સોમવારે ૫૧૭૫૧ અને રવિવારે

સૌથી વધુ ૬૩,૨૯૪ લોકો કોરોનાથી

સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર

સુધી કુલ ૩૫,૭૮,૧૬૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાના

કાલ રાત્રે ૮ કલાકથી ૧૫ દિવસ

માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો

એક મે સુધી યથાવત રહેશે. મુખ્યમંત્રી

ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજ્યમાં નવા

નિયમોની જાહેરાત કરી હતી.

February 25, 2021.

રહ્યુ છે.

હોસ્પીટલમાં એક દિવસમાં ૧૨૦ છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક,

એક જ દિવસમાં...

ચાંદીના વાયદાઓમાં ચાંદી કામકાજ થયાં હતાં. સોનાના મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૭૭૦૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૧૭૦ અને નીચામાં રૂ.૬૭૭૦૫ ના સ્તરને નીચામાં રૂ.૪૬૬૮૦ ના મથાળે વધીને રૂ.૬૭૯૭૩ બંધ રહ્યો હતો. અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૯ ચાંદી-મિની એપ્રિલ રૂ.૩૦૩ વધીને

એનજી

OFFER OPENING PUBLIC ANNOUNCEMENT TO THE SHAREHOLDERS OF

(CIN: L51909GJ1993PLC019111) ("TSL" / TARGET COMPANY"/"TC")

Registered Office: FF-6, Amrapali Apartment, Near Air Force Station, Makarpura Vadodara-390014, Gujarat, India | Phone No. +910265-2652851 Email: towasurvey@yahoo.co.in | Website: www.towasokki.in

This Advertisement is being issued Beeline Broking Limited, on behalf of Mr. Sudhir Mehta ("Acquirer") pursuant to regulation 18(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI (SAST) Regulations") in respect of Open Offer ("Offer") for the acquisition up to 11,84,248 (Eleven Lacs Eighty Four Thousand Two Hundred Forty Eight Only) of ₹ 10/- each representing 26.00 % of the total equity and voting

share capital of the Target Company, at a price of ₹ 6/- (Rupees Six Only) per Equity share ("Offer Price") payable in cash in terms of Regulation 3(1) and 4 of the SEBI (SAST) Regulations, 2011. The Detailed Public Statement ("DPS") pursuant to the

Public Announcement ("PA") made by the Acquirer have appeared in Financial Express (English Daily) all editions, Jansatta (Hindi Daily) all editions, Loksatta Jansatta (Gujarati) (Baroda/Vadodara edition) and Mumbai Lakshadeep (Marathi Daily) on

Committee of Independent Directors ("IDC") of the Target Company of the opinion that the Offer Price of ₹ 6/- (Rupees Six Only) offered by the Acquirer is in accordance with the relevant regulations prescribed in the Takeover Code and prima facie

appear to be justified. The recommendation of IDC was published in the aforementioned newspapers on April 15, 2021. The offer is not a competing offer in terms of Regulation 20 of the SEBI (SAST) Regulations. There was no competing offer to this Open Offer and the last date for making such competing offer has expired.

The completion of dispatch of the Letter of Offer ("LOF") to all the Public Shareholders of Target Company was completed

Please note that a copy of the LOF is also available on the website of Securities and Exchange Board of India (SEBI)

www.sebi.gov.in and also on the website of Manager to the Offer, www.beelinebroking.com and BSE Limited at www

Public Shareholders are required to refer to the Section titled "Procedure for acceptance and Settlement" on Point no. 8 at beginning of Page no. 16 of the Letter of Offer in relation to the procedure for tendering their Equity Shares in the Open Offer

Public Shareholders holding Equity Shares in physical form may participate in the Offer by approaching their respective Broker/Selling Broker and tender Shares in the Open Offer as per the procedure along with other details as mentioned in

Eligible Person(s) may participate in the Offer by approaching their respective Broker/Selling Broker and tender Shares in the Open Offer as per the procedure along with other details as mentioned in Point 8.10 of the Letter of Offer. In terms of Regulation 16(1) of the SEBI (SAST) Regulations, the Draft Letter of Offer had been submitted to SEBI or March 04, 2021. We have received the final observations in terms of Regulation 16(4) of the SEBI (SAST) Regulations from SEBI vide its Letter No. SEBI/HO/CFD/DCR III/OW/7195 dated March 26, 2021 which have been incorporated in the LOF.

To the best of the knowledge of Acquirer, there are no statutory or other approval(s) required by the Acquirer to complete the Acquisition under the SPA and under the Open Offer as on the date of advertisement. If, however, any statutory or other approval(s) becomes applicable prior to completion of such acquisition, the Offer would also be subject to such other

Date

February 17, 2021

February 25, 2021

March 04, 2021

March 19, 2021

March 26, 2021

March 31, 2021

April 08, 2021

April 15, 2021

April 16, 2021

April 16, 2021

April 19, 2021

May 3, 2021 May 18, 2021

The Offer Price is ₹ 6/- (Rupees Six Only) per equity share payable in cash ("Offer Price").

વાયદાઓમાં મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ બેરલદીઠ રૂ.૪૭૪૩ ખૂલી, ઊપરમાં બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટીને રૂ.૪૭૩૩ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૬૭૨ સોદાઓમાં કુલ રૂ.૪૦૭.૫૯ કરોડનાં કામકાજ થયાં હતાં. ખૂલી, ઊપરમાં રૂ.૪૬૮૯૬ અને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૫ કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૮૯૦ અને નીચામાં રૂ.૬૭૯૬૭ અને ચાંદી-માઈક્રો રૂ.૨૧૬૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ એપ્રિલ રૂ.૩૧૧ વધીને રૂ.૬૭૯૭૧ અંતે રૂ.૧૯૦ વધીને રૂ.૨૧૮૭૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ એપ્રિલ સેગમેન્ટમાં કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૬૪.૧ સોદાઓમાં ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮

વાયદો કિલોદીઠ રૂ.૯૬૦.૧ ખૂલી, નીચામાં રૂ.૧૩૨૮.૫ સુધી જઈ

અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૭ સીપીઓમાં ૧૮૭૮ સોદાઓમાં રહ્યો હતો.

મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક અંતે રૂ.૧૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૨૪૨૬.૫૯ કરોડનો ધંધો થયો વધીને બંધમાં રૂ.૧૬૨ ના ભાવ વધી બંધમાં રૂ.૧૬,૫૩૭ના ભાવ રૂ.૩૩૫.૪૪ કરોડનાં ૨૯૪૬૦ સુધારો વાયદાના ભાવમાં થયો હતો. રૂ.૪૬૩૧ થયા હતા, જ્યારે સોનું- હેતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ થયા હતા. વાયદાઓમાં કામકાજની ટેન, મેન્થા તેલમાં ૪ સોદાઓમાં દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં રૂ.૪૧.૫૦ લાખનાં ૪.૩૨ ટન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના રૂ.૨૩૫ વધીને બંધમાં રૂ.૪૬૫૫૨ રૂ.૪૭૭૨ અને નીચામાં રૂ.૪૬૯૫ ઊપરમાં રૂ.૯૬૩ અને નીચામાં સોનાના વિવિધ વાયદાઓમાં રબરમાં ૬૫ સોદામાં રૂ.૧.૨૩ રૂ.૯૫૬.૨ રહી, અંતે રૂ.૯૬૦.૬ મળીને ૧૭૮૭૩ સોદાઓમાં કુલ કરોડનાં ૭૪ ટન, કપાસમાં ૨ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ રૂ.૨૧૪૧.૩૮ કરોડ ની કીમતનાં સોદાઓમાં રૂ.પ.૩૩ લાખનાં ૮ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૩૮.૫ 🛮 ૪૫૭૭.૫૬૧ કિલો, ચાંદીના વિવિધ 🗡 ટનના વેપાર થયા હતા. ઓપન ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩૮.૫ અને વાયદાઓમાં મળીને પ૯૨૫૮ ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના સોદાઓમાં કુલ રૂ.૨૦૨૫.૪૪ વાયદાઓમાં ૧૬૧૦૭.૬૯૨ કિલો, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને કરોડ ની કીમતનાં ૨૯૭.૭૧૭ ચાંદીના વાયદાઓમાં ૪૪૭.૭૧૭ રૂ.૧૩૩૩.૫ ના સ્તરે બંધ રહ્યો ટન, ક્રૂડ તેલમાં ૧૬૬૯૫ ટન, ક્રૂડ તેલમાં ૮૭૨૮ બેરલ્સ, હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ સોદાઓમાં રૂ.૧૧૫૯.૩૨ કરોડનાં કોટનમાં ૨૩૦૦૦૦ ગાંસડી, કિલોદીઠ રૂ.૧૬,૪૫૨ના સ્તરે ૨૪૪૮૨૦૦ બેરલ્સ, કોટનમાં સીપીઓમાં ૯૫૫૮૦ ટન, મેન્થા ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૫૮૮ અને ૭૨૩ સોદાઓમાં રૂ.૭૦.૪૬ તેલમાં ૪૬.૪૪૮ન, રબરમાં ૨૫૭ નીચામાં રૂ.૧૬,૪૫૨ના મથાળે કરોડનાં ૩૨૧૨૫ ગાંસડી, ટન અને કપાસમાં ૧૧૬ ટનના સ્તરે

આથી તમામ સંબંધિતો અને જાહેર જનતાની જાણ અર્થે નોટીસ આપી

ખાતદારના વિગતા							
ક મ.	કરજદારનું નામ	ભાવા ગુંભર	લોનની મુદ્લ રકમ (રૂપિયામાં)	ગ્રોસ વજન (ગ્રામમાં)	નેટ વજન (ગ્રામમાં)		
٩.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ <i>૬</i> ૨૦૦૦૧૪૨૫૪	90,33,000/-	308.5	300.00		
٤.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ૬૧ ૦૦૦૨૪૧૬૩	۹,3८,०००/-	80.5	34.४		
3.	રામેશ્વર શાંતિલાલ સોની	960665500098559	१०,६५,०००/-	368	380		
۶.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨૪૮૩૩	₹,90,000/-	9 ८ .6	96		
ч.	રામેશ્વર શાંતિલાલ સોની	96066300055640	४,२०,०००/−	996.3	૧૧૩ .૬		
Ģ.	રામેશ્વર શાંતિલાલ સોની	96665500098586	ч,39,000/-	૧૫૬.૯	૧૫૬		
७.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨૩૩૯७	3,00,000/-	990	૧૦૨		
۷.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶૧ ૦૦૦૨૪૪૧૧	90,00,000/-	560·A	508∙6		
e.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶૧ ૦૦૦૨૪૮૯૦	५५,०००/-	૧૫.૪	૧૫		
90.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨3७४४	८१,०००/-	50.5	55		
99.	રામેશ્વર શાંતિલાલ સોની	१८०६५१०००२५१७८	٩,२०,०००/-	36	3 e		
۹2.	રામેશ્વર શાંતિલાલ સોની	१८०६५२०००१४२०५	6,30,000/-	530.6	ર૧૫.૮		
٩3.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨33૮૯	₹,₹0,000/-	90	90		
٩૪.	दर्शन सोनी	૧૮ ૦૯ ۶૨ ૦૦૦૧૪૧૮૯	પ,૨૦,૦૦૦/−	2 4 9.3	૧૩૮.પ		
٩ų.	दर्शन सोनी	969500098595	٩२,८३,०००/-	४ ٩3	305		
٩۶.	दर्शन सोनी	૧૮ ૦૯ ۶૨૦૦ ૦૧૪૨७૦	93,64,400/-	४ 3४.ч	४०४.५		
96.	दृर्शन सोनी	૧૮ ০૯ ۶૨ ০০০ ૧ ૪০૮০	४,५५,०००/-	૧૨૧	૧૨૧		
٩८.	दृर्शन सोनी	૧૮ ૦૯ ۶૨ ૦૦૦૧૩७ ۶ ૯	٩,3२,०००/-	38.0	38.6		
۹ę.	दर्शन सोनी	૧૮ ૦૯ ۶૧ ૦૦૦૨3४૨૧	૧, ૬૫,૦૦૦/–	४ е-е	४७		
50.	दर्शन सोनी	9666400053553	e,७9,०००/-	3૧૯.3૫	240.3		
٤٩.	दर्शन सोनी	969900053068	2,62,000/-	65. θ	७ ૧		
	તારીખ : ૧૬/૦૪/૨૦૨૧ ઇ ફેડરલ બેંક લી. સ્થળ : વડોદરા શાખા પ્રબંધક, સમા શાખા, વડોદરા						

સમા શાખા, વિસ્મય કોમ્પલેક્ષ, દા ફેડરલ બેંક લી. જીઆઈપીસીએલ સર્કલ પાસે, વડોદરા. ગોલ્ડ લોન- વેચાણ નોટીસ

જણાવવામાં આવે છે કે ધ ફેડરલ બેંકની સમા શાખામાં નીચે જણાવેલ ગોલ્ડ લોન ખાતાઓમાં ગીરો મુકવામાં આવેલ સોનાના આભુષણો છોડાવવા માટે સમયસર ચુકવણું કરવામાં આવેલ નથી અને વારંવારની નોટીસ આપવા છતાં ચુકવણું કરાચેલ ન હોઈ, જો તે ખાતાઓ તા.૨૩/૦૪/૨૦૨૧ ના રોજ અથવા તે પહેલા બંધ કરવામાં નહીં આવે તો હરાજી દ્ધારા વેચાણ કરવામાં આવશે.

-		ं जाटाहारमा ।पगट		_	
ક મ.	કરજદારનું નામ	ખાતા નંબર	લોનની મુદ્લ રકમ (રૂપિયામાં)	ગ્રોસ વજન (ગ્રામમાં)	નેટ વજન (ગ્રામમાં)
٩.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮૦૯ ۶૨૦૦૦૧૪૨૫૪	90,33,000/-	308.5	300.00
5.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮૦૯ ૬૧૦૦૦૨૪૧૬૩	۹,3८,०००/-	80.5	34∙४
3.	રામેશ્વર શાંતિલાલ સોની	969500098559	१०,६५,०००/-	368	380
۶.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨૪૮33	₹,90,000/-	9 ८ .6	96
ч.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮૦૯ ૬૧૦૦૦૨૨૯૧૦	४,२०,०००/−	996.3	૧૧૩ .૬
ç.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶૨ ૦૦૦૧૪૨४७	५,3 ६,०००/-	૧૫૬.૯	૧૫૬
७.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶ ૧૦૦૦૨33૯७	3,60,000/-	990	૧૦૨
۷.	રામેશ્વર શાંતિલાલ સોની	96066400058849	90,00,000/-	560·A	508.€
e.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮ ૦૯ ۶૧ ૦૦૦૨૪૮૯૦	чч, 000/-	૧૫.૪	૧૫
90.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮૦૯ ۶૧૦૦૦૨3७४४	/٩,٥٥٥/-	50.5	55
99.	રામેશ્વર શાંતિલાલ સોની	१८०६५१०००२५१७८	٩,२०,०००/-	36	3 c
٩2.	રામેશ્વર શાંતિલાલ સોની	१८०६५२०००१४२०५	6,30,000/-	530.6	२१प∙८
۹3.	રામેશ્વર શાંતિલાલ સોની	૧૮૦૯ ۶૧૦૦૦૨33૮૯	2,20,000/-	90	90
98 .	दर्शन सोनी	૧૮ ૦૯ ۶૨ ૦૦૦૧૪૧૮૯	પ,૨૦,૦૦૦/−	૨૫૧.૩	१ 3८.प
૧૫.	दर्शन सोनी	960665500098565	۹२,८3,०००/-	४ ٩3	365
٩۶.	दर्शन सोनी	૧૮ ૦૯ ۶૨૦૦ ૦૧૪૨७૦	93,64,400/-	४ 3४₊ч	४०४.५
٩७.	दृर्शन सोनी	9695500098060	४,५५,०००/-	૧૨૧	૧૨૧
٩८.	दृर्शन सोनी	969550004309 6	٩,3२,०००/-	38.0	38.6
૧૯.	दर्शन सोनी	૧૮૦૯ ૬૧૦૦૦૨૩૪૨૧	૧,૬૫,૦૦૦/–	86.6	४७
50.	दर्शन सोनी	9666400053553	e,69,000/-	396.34	240·3
٤٩.	दर्शन सोनी	96999999399	2,62,000/-	65. θ	७ ૧
	દીખ : ૧૬/૦૪/૨૦૨૧		દા ફેડરલ		
સ્થ	ળ : વડોદરા	શાખ	ા પ્રભંધક, સમ	ા શાખા, વ	વટોદરા

Chemcon Speciality Chemicals Limited (AN ISO 9001:2015 and ISO 14001:2015 Control 1)

Regd. Office: Block No. 355, Manjusar Kunpad Road, Village: Manjusar, Taluka: Savli, Vadodara – 391775 CHEMCON Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: 0265 – 2981195 Statement of Deviation / Variation in utilization of funds raised in IPO

Original Modified Original Modified			3. Gener	al corporate purposes.	Remarks	
			Manuf 2. Fundir	Manufacturing Facility, 2. Funding working capital requirements		
		raicad and who		1.10		
		after review	Nil			
				Not Applicable		
		val	Not Appl	Not Applicable		
		nich was	Not Appl	Not Applicable		
			Not Appl	hla		
			ed Yes / No			
				ank Limited		
ng Agency	tuartor orrada			,		
)uarter ended				<u>e) </u>	
Date of Raising funds Amount Raised						
				QIP / Others		
	Fund raising fund Raised led for the Cong Agency ag Agency a Deviation / Deviation / Deviation for the Soft a contract by the shaute of sharefion for the Lots of the Auts of the Auts of the Auts of which furs been a dev	Raised led for the Quarter ended ng Agency ng Agency Name, if applic Deviation / Variation in u nether the same is pursua of a contract or objects, w by the shareholders atte of shareholders Appro ion for the Deviation / Var ts of the Audit Committee ts of the Auditors, if any or which funds have been a deviation, in the f	Fund raising taising funds Raised led for the Quarter ended ng Agency ng Agency Name, if applicable I Deviation / Variation in use of funds raise ther the same is pursuant to change of a contract or objects, which was I by the shareholders te of shareholders Approval ion for the Deviation / Variation ts of the Audit Committee after review ts of the Auditors, if any or which funds have been raised and whe s been a deviation, in the following table	Fund raising Public Is Issues /- Issued INR 1656 Reled for the Quarter ended December of Applicable HDFC Bit Issues /- In Beviation / Variation in use of funds raised December of a contract or objects, which was It by the shareholders Approval Information of the Deviation / Variation Information of the Audit Committee after review Its of the Auditors, if any Information Information of Which funds have been raised and where Is been a deviation, in the following table Information Inf	Fund raising Public Issues / Rights Issues / Preference Issues / QIP / Others Raised Raised INR 1650 Million (through Fresh Issuered December 31, 2020) Rapplicable / Not Applicable / Not Applicable / HDFC Bank Limited Repert of a contract or objects, which was a log harmonic of shareholders Approval is of the Audit Committee after review its of the Auditors, if any for which funds have been raised and where is been a deviation, in the following table Public Issues / Rights Issues / Preference Issues / QIP / Others September 29, 2020 (Allotment Date in INR 1650 Million (through Fresh Issues / QIP / Others September 29, 2020 (Allotment Date in INR 1650 Million (through Fresh Issues / QIP / Others INR 1650 Million (through Fresh Issues / QIP / Others September 29, 2020 (Allotment Date in INR 1650 Million (through Fresh Issues / QIP / Others Not Applicable in Not Applicable Not Applicable in Not Applicable Not Applicable in Not Applicable Not Applicable in Not Ap	

(a) Deviation in the objects or purposes for which the funds have been raised; or (b) Deviation in the amount of funds actually utilized as against what was originally disclosed; or

(c) Change in terms of a contract referred to in the fund raising documents i.e, prospectus, letter of offer, etc

For Chemcon Speciality Chemicals Limited

Rajesh Gandhi Chief Financial Officer

Date: 13-02-2021

Place: Vadodara

પશ્ચિમ રેલવે સુરત - સુબેદારગંજ, વડોદરા જંકશન - સુબેદારગંજ અને વડોદરા જંકશન - દાનાપુર વચ્ચે ઉનાળુ વિશેષ ટ્રેન દોડાવશે



ટ્રેન iબર	મૂળ સ્ટેશન અને ગંતવ્ય સ્થળ	લારીખ શરૂઆતની	પ્રસ્થાન	आंगमन
૯૧૨७	સુરત - સુબેદારગંજ	૧૯-૦૪-૨૦૨૧ અને	૦७.૦૦ કલાકે	૦૯.૦૦ કલાકે
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	૨૬-૦૪-૨૦૨૧	(સોમવાર)	(ગુરુવાર)
૯૧૨૮	સુબેદારગંજ - સુરત	૨૦-૦૪-૨૦૨૧ અને	૧૨.૫૦ કલાકે	૧૨.૪૫ કલાકે
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	૨७-૦૪-૨૦૨૧	(મંગળવાર)	(બુધવાર)

રોકાણ: બેને દિશાઓમાં ભરુચ જેક્શન, વડોદરા જેક્શન, ગૌધરા જેક્શન, દાહોદ, રતલામ જેક્શન, નાગદા જેક્શન, કોટા જેક્શન સવાઈમાધોપુર, ગંગાપુર સિટી, હિન્ડોન સિટી, બચાના જંક્શન, આગ્રા ફોર્ટ, ઈટાવા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો.

રચના : એસી-ર ટાયર કમ એસી - 3 ટાયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોય						
વડોદરા જંકશન - સુબેદાર જંકશન	૧७-૦૪-૨૦૨૧ અને	૦૯.૧૫ કલાકે	06.80			

06939	વડોદરા જંક્શન - સુબેદાર જંક્શન	૧૯-૦૪-૨૦૨૧ અને	૦૯.૧૫ કલાકે	૦૯.૪૦ કલાકે
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	૨૪-૦૪-૨૦૨૧	(શનિવાર)	(રવિવાર)
96635	સુબેદાર જંક્શન - વડોદરા જંક્શન	૧૮-૦૪-૨૦૨૧ અને	૧૨.૫૫ કલાકે	૧૧.૧૫ કલાકે
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	૨૫-૦૪-૨૦૨૧	(રવિવાર)	(સોમવાર)

રોકાણ : બંને દિશાઓમાં ગોધરા જંકશન, દાહોદ, રતલામ જંકશન, નાગદા જંકશન, કોટા જંકશન, સવાઇમાધોપુર, ગંગાપુર સિટી, હિન્ડોન સિટી, બચાના જંકશન, આગ્રા ફોર્ટ, ઈટાવા અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો.

રચના : ૧ એસી, એસી-૩ ટાયર સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ

०૯૧૨૯	વડોદરા જંક્શન - દાનાપુર	૧૯-૦૪-૨૦૨૧ અને	૦૮.૨૫ કલાકે	૧૯.૩૦ કલાકે	
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	२६-०४-२०२१	(સોમવાર)	(મંગળવાર)	
06930	દાનાપુર - વડોદરા જંક્શન	૨૦-૦૪-૨૦૨૧ અને	રર.૪૫ કલાકે	૦૯.૨૫ કલાકે	
	(સુપર ફાસ્ટ સ્પેશિયલ - સ્પેશિયલ ભાડા સાથે)	२७-०४-२०२ ٩	(મંગળવાર)	(ગુરુવાર)	

રોકાણ: બંને દિશાઓમાં ગોધરા જંકશન, દાહોદ, રતલામ જંકશન, નાગદા જંકશન, કોટા જંકશન, સવાઈમાધોપુર, ગંગાપુર સિટી, હિન્ડોન સિટી, બચાના જંકશન, ફતેપુર સીકરી, ઈંદગાહ આગ્રા જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડલા જંકશન, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી જંકશન, ફૈઝાબાદ જંકશન, અચોધ્યા, શાહગંજ જંકશન, વારાણસી, પંડીત દિન દયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો.

રચના : ૧ એસી, એસી-૩ ટાયર સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ સીટીંગ કોય

ફેરાનું વિસ્તરણ

ટ્રેન નં. ૦૫૧૮૨/૮૧ બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર ઉનાળુ સ્પેશિયલ

બાંદ્રા ટર્મિનસથી : ૧૯-૦૪-૨૧ (સોમ), ૨૩-૦૪-૨૧ (શુક્ર), ૨७-૦૪-૨૧ (મંગળ) અને ૦૧-૦૫-૨૧ (શનિ) - ૪ ફેરા ગોરખપુરથી : ૧७-૦૪-૨૧ (शनि), ૨૧-૦૪-૨૧ (બુધ), ૨૫-૦૪-૨૧ (રવિ) અને ૨૯-૦૪-૨૧ (ગુરુ) - ४ ફેરા

ટ્રેન નં. ૦૫૧૮૪/૮૩ સુરત - ગોરખપુર ઉનાળુ સ્પેશિયલ

સુરતથી: ૧૯-૦૪-૨૧ (સોમ), ૨૩-૦૪-૨૧ (શુક્ર), ૨७-૦૪-૨૧ (મંગળ) અને ૦૧-૦૫-૨૧ (શનિ) - ૪ ફેરા ગોરખપુરથી: ૧૮-૦૪-૨૧ (રવિ), ૨૨-૦૪-૨૧ (ગુરુ), ૨૬-૦૪-૨૧ (સોમ) અને ૩૦-૦૪-૨૧ (શુક્ર) - ૪ ફેરા

ટ્રેન નં. ૦૯૦૪૯/૫૦ મુંબઈ સેન્ટ્રલ-સમસ્તીપુર રોશિયલ ટ્રેનોના સંચાલનમાં વધારો					
ટ્રેન નંબર ૦૯૦૪૯ની સુધારેલી તારીખ	ટ્રેન નંબર ૦૯૦૫૦ની સુધારેલી તારીખ				
મુંબઈ સેન્ટ્રલ - સંમસ્તીપુર	સમસ્તીપુર - મુંબઈ સેન્ટ્રલ				
સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર	બુધવાર, ગુરુવાર, શનિવાર અને સોમવાર ૧७, ૧૯, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૨૯ એપ્રીલ, ૨૦૨૧				
७, ૧૯, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ^૨ ७ અને ૨૯ એપ્રીલ, ૨૦૨૧	૧७, ૧૯, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૨૯ એપ્રીલ, ૨૦૨૧ અને ૧ મે. ૨૦૨૧				

ટ્રેન નં. ૦૯૧૨७, ૦૯૧૩૧ અને ૦૯૦૪૯નું બુકિંગ તા.૧૬.૦૪.૨૦૨૧થી અને ૦૯૧૨૯, ે૦૫૧૮૨ અને ૦પ૧૮૪નું બુકિંગ તા. ૧७. ૦૪. ૨૦૨૧થી નિર્ધારિત PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઈટ પર શરુ થશે.

રોકાણ સંબંધિત સમય બાબતે વિગતવાર જાણકારી માટે યાત્રીઓ કૃપયા મુલાકાત લે www.enquiry.indianrail.gov.in


ફક્ત આરક્ષિત ટીકીટવાળા યાગીઓને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે. યાગીઓની બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ - ૧૯ સંબંધિત તમામ ધોરણો અને SOPનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.



પશ્ચિમ રેલવે www.wr.indianrailways.gov.in



બધી આરક્ષિત ટિકિટો માટે ઓળખપત્ર સાથે રાખો.



<u>જાહેર નિવિદા</u>

માઈનોર સીવીલ વર્કસની વિવિધ કામગીરી જેવી કે મકાન રીપેરીગ, પથ્થર દિવાલ પોઈન્ટીગ,ગોકાઉન રીપેરીગ, નાના ચેકકેમ, રસ્તાનું કામ, સી.સી.રોડ, આર.સી.સી. રોડ, કલરકામ, ફ્રેન્સીગ, ફ્રેન્સીગ રીપેરીગ જેવી જુદી જુદી કામગીરીમાં રસ ધરાવતા ઈજારદાર / ઈસમોને જણાવવાનું કે, બારીયા વન વિભાગની કાર્યક્ષેત્રમાં આવતી નીચે મુજબની જુદી જુદી રેંજોમાં સીવીલ વર્કસની કામગીરી માટેના ઇજારદારો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. તે અંગેના ટેન્ડર ફોર્મ જુદી જુદી રેંજ માંથી મેળવી જેતે રેંજમાં જમા કરાવવાના રહેશે.

રેંજ કચેરીએ ટેન્ડર મેળવવાની તા.૨૭/૦૪/૨૦૨૧ થી જાહેર રજાના દિવસો સિવાય કરોરી સમય દરમ્યાન

રેંજ કચેરીએ ટેન્ડર બોક્ષમાં નાખવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૧ સમય ૧૨.૦૦ કલાક સુધી

રેંજ કચેરીએથી ટેન્ડર ખોલવાની તા.૩૦/૦૪/૨૦૨૧ સમય ૧૩.૦૦ કલાકે

	અ.નં	રેંજનું નામ	સરનામું
	٩	બારીયા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, બારીયા
			પીઠા પ્લોટ, ફોરેસ્ટ કોલોની, ધાનપુર રહેક, દે.બારીય
	5	સાગટાળા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, સાગટાળા
			મુ.સાગટાળા, તા.દે.બારીયા જી.દાહોદ
	3	ધાનપુર	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ધાનપુર
			ફોરેસ્ટ કોલોની ધાનપુર પશુ દવાખાનાની બાજુમાં
	४	વાંસીયાડુંગરી	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, વાંસીયાડુંગરી
			મુ.લીલાઆંબા વાકોટા રોક પો.મંકોર તા.ધાનપુર
	પ	દાહોદ	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, દાહોદ
i			મુ.દાહોદ ફોરેસ્ટ કોલોની તા.જી.દાહોદ
	ξ	રામપુરા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, રામપુરા
			મુ.દાહોદ ગડીમાં તા.જી.દાહોદ
	9	ઝાલોદ	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ઝાલોદ
			મુ.ઝાલોદ જુની મામલતદા૨ કચેરીની બાજુમાં
	6	ક તેપુરા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ફતેપુરા
			મુ.ફતેપુરા ઝાલોદ રોક, મામલતદાર કચેરીની સામે
	6	સંજેલી	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, સંજેલી
			મુ.પો.સંજેલી, તા.સંજેલી જી.દાહોદ
	90	ગરબાકા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, ગરબાડા
		0 3	મુ.પો.ગરબાડા તા.ગરબાડા જી.દાહોદ
	99	લીમખેડા	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, લીમખેડા
			મુ.પાલ્લી ધાનપુર રોક તા.લીમખેકા જી.દાહોદ
	૧૨	સરજુમી	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, સરજુમી
			મુ.દુધીયા ફોરેસ્ટ કોલોની તા.લીમખેડા જી.દાહોદ
	૧૩	રણધીકપુર	પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી, રણઘીકપુર
			મુ.સીગવઙ, તા.લીમખેડા જી.દાહોદ

નોધઃ (૧) રૂા.૨૫૦૦/– ની ટેન્ડર ફી કેશ સ્થળ ઉપર ભરવાની રહેશે. (નોન રીફંડેબલ છે.)

(૨) નાયબ વન સંરક્ષકશ્રી બારીયાના નામે રૂા.૧,૫૦,૦૦૦/– ની અનુસૂચિત બેંકમાં કઢાવેલી EMD જમા કરાવવાની રહેશે. (રીફ્કેબલ) (૩) એક એજન્સી એકથી વધુ રેંજમાં ટેન્કર ભરી શકશે નહિં.

(આર.એમ.પરમાર) નાયબ વન સંરક્ષક (માહિલી-દાહોદ-૧૨-૨૦૨૧-૨૨)

Company shall give its recommendation Last date for revising the Offer Price Advertisement of Schedule of activities for open offer, status of statutory and other approvals in newspapers and sending to SEBI, Stock Exchanges and Target Company Date of Opening of the Offer Date of Closure of the Offer Payment of consideration for the acquired shares

Date by which letter of offer be dispatched to the shareholders

Last Date by which the committee of the independent directors of the Target

In case the Equity Shares are held in physical form:

b. In case the Equity Shares are held in dematerialised form:

Any other material change from the date of PA:. Nil

Publication of Detailed Public Statement in newspapers

Receipt of comments from SEBI on draft letter of offer

Last date of filing draft letter of offer with SEBI

Point 8.11 of the Letter of Offer.

Stautory and Other Approvals:

statutory or other approval(s).

10. Schedule of Activities:

Last date for a Competing offer

Public Announcement

Identified date3

Place: Ahmedabad

*Identified Date is only for the purpose of determining the names of the shareholders as on such date to whom the Letter of Offer would be sent. All owners (registered or unregistered) of equity shares of the Target Company (except the parties to the SPA including persons deemed to be acting in concert with such parties) are eligible to participate in the Offer any time before the Closure of the Offer. Capitalized terms used in this announcement, but not defined, shall have the same meaning assigned to them in the PA, DPS and LOF. ISSUED BY THE MANAGER TO THE OFFER ON BEHALF OF THE ACQUIRER - MR. SUDHIR MEHTA

Manager to the Offer BESLINE

> **BEELINE BROKING LIMITED** CIN: U51900GJ2014PLC080598 SEBI Reg. No.: INM000012546 Contact Person: Mrs. Khusbu Shah

Registered Office Address:. 701-702, A Wing, Samudra Complex, 7th Floor, Off. C.G. Road, Nr. Girish Cold Drinks, Navrangpur Ahmedabad Gujarat-380009. Merchant Banking Division: 807, Phoenix Tower, Opp. New Girish Cold Drinks, Near Vijay Cross Road, Navrangpura, Ahmedabad-380 009

Tel. No.: +91-79-48405357/6357;

Email: mb@beelinemb.com | Website:www.beelinebroking.com



Date: April 15, 2021

Day

Wednesday

Thursday

Thursday

Wednesday

Thursday

Thursday

Friday

Friday

Monday

Tuesday

Friday

Friday



TENDERS & NOTICES =

TATA Sky Broadband

Dear Customer, we at Tata Sky Broadband Private Limited ('TSBB') are committed to providing you with the best possible service. For any reason if you are not satisfied with our services or have any queries, you may contact us as under:

- TSBB Customer Care Number: 1-800-267-6771 (toll free) is available 24 hours on all days of the week. Please remember to take the docket/complaint number once your compliant is registered by the customer care executive.
- @ If you are not satisfied with our response or your complaint remains unaddressed, you may make an appeal to the Appellate Authority, Mr. Surject Mahapatra at appellateauthority@tataskybb.com or call on 7982616399 from 9:30 am to 6:30 pm (Monday to Friday).
- To access the status of your complaint in the 'Web-based Complaint Monitoring System', log on to

https://myaccount.tataskybroadband.com/Selfcare/

For all other terms & conditions, please visit www.tataskybroadband.com

Registered Office: Unit 306, 3rd Floor, Windsor, Off C.S.T. Road, Kalina, Santacruz (East), Mumbai 400098. CIN.: U64204MH2015PTC267808

TATA® Tata Sons Private Limited. All Sky Trademarks, and any intellectual property they contain, and owned by Sky International AG. Used under License by Tata Sky Limited.

UNDER INSOLVENCY AND BANKRUPTCY CODE, 2016

SURANA INDUSTRIES LIMITED CIN: L27104TN1991PLC020533

Leased Land & Building, Plant & Machinery & Spares, Stores & Consumables on "As is where is basis", "As is what is basis", "Whatever there is basis" and "Without recourse basis"

basis and Wallout Icoodi	oc basis	
DESCRIPTION OF THE ASSET	RESERVE PRICE* (Rs.)	EARNEST MONEY DEPOSIT (Rs.)
LOT A - (At Raichur – Karnataka) Immovable Properties of Leasehold factory land bearing Plot Nos. 231,232,233 and 234 comprised in Survey No. Parts of 224 to 229, 240 & 230, 232, 233,235 to 239 of Wadaloor Village & 99 (P), 128 (P) of Chicksugar Village, Raichur Hobli, Raichur Taluk, Raichur District, in the State of Karnataka (Leasehold Land: 131.55 Acres) (Lessor: KIADB) Industrial Sheds constructed in the above land. Canteen Room, Admin Block and Main Stores building. Plant & Machinery, Inventory and Spares, Stores and Consumables in the above factory premises.	105,00,00,000	

*The above mentioned Reserve Price is exclusive of GST @ 18% E- Auction Date: 30/04/2021 (Time: 11.00 AM - 1.00 PM) Last date for Submission of EMD: 28/04/2021 (Before 06.00 PM) Bid increment Value: Rs. 10,00,000/- (For each LOT)

VISIT: https://ncltauction.auctiontiger.net - To know about the details of the properties.

Also download the Process Memorandum and sale notice to know the

terms and conditions of the auction For E-Auction Details Contact : Mr. Praveen Thevar, Mob: +91 97227 7882 RAMAKRISHNAN SADASIVAN . Liquidator

Surana Industries Limited - In Liquidation
IBBI/IPA-001/IP-P00108/2017-18/10215
Address: Old No 22, New No 28, Menod Street, Purasawalkam, Tamil Nadu, Chennai 600 007.

Phone No: 94444 55982 E-Mail Id: silauction@gmail.com

Alternate E-Mail Id: sadasivanr@gmail.com



Hindustan Unilever Limited

Registered Office: Unilever House, B. D. Sawant Marg, Chakala Andheri East, Mumbai 400 099. CIN: L15140MH1933PLC002030, Web: www.hul.co.in, Email: levercare.shareholder@unilever.com, Tel: +91 22 5043 3000 / 5043 3070

NOTICE

Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 29th April, 2021 through Audio-visual means, inter-alia, to consider the Audited Standalone and Consolidated financial results for the quarter and year ended 31st March, 2021 and to recommend final dividend, if any, on equity shares for the said period.

> For Hindustan Unilever Limited Dev Bajpai

Executive Director Legal and Corporate Affairs Date: 14th April 2021 & Company Secretary DIN: 00050516 / FCS No: F3354 Place: Mumbai

The Notice is also available at Investor Relations section of the Company's website <u>www.hul.co.in</u> and corporate announcement section of www.nseindia.com and www.bseindia.com



TATA CONSUMER PRODUCTS LIMITED

(Formerly Known as Tata Global Beverages Limited) CIN: L15491WB1962PLC031425 Registered Office : 1, Bishop Lefroy Road, Kolkata-700020 Tel: +91 033 22813779/3891, Fax : 033-22811199

E-mail id: investor.relations@tataconsumer.com, Website: www.tataconsumer.com NOTICE
Notice is hereby given, pursuant to Regulation 47 read with

Regulations 29 and 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, May 6, 2021 inter-alia, to consider and approve the Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and vear ended on March 31, 2021, and to consider recommendation of a final dividend, if any, on the equity shares of the Company for the financial year ended March 31, 2021.

This intimation is available on the website of the Company at www.tataconsumer.com and also on the website of Stock Exchanges where the shares of the Company are listed, viz., www.bseindia.com

For Tata Consumer Products Limited Place · Mumbai Neelabja Chakrabarty Company Secretary

GUJARAT ENERGY TRANSMISSION CORPORATION LTD. H O. Sardar Patel Vidyut Bhavan, Race Course, Vadodara - 390 007

Dept-GOG: http://guj-epd.gov.in GETCO: www.getcogujarat.com Tender Notice No. ACE:Proc:TN-01:21-22

[A] PROCUREMENT: (1) ACE(Proc)/E-2835/III/LA/2021-22 (2) ACE(Proc)/E-2828/

[B] LINE: GETCO/TR-II/TL/66kV/S&E/2510: Supply, Erection, Testing & Commissioning of (1) 66kV D/C line from 400kV Bhogat S/S to 66kV Kalyanpur S/S on M/C & D/C tower with ACSR Panther conductor having length 18.827 RKM under KISAN SURYODAY YOJANA (KSY) & (2) LILO of 66kV Bhatia - Lamba H-frame line at 400kV Bhogat S/S on M/C & D/C tower with ACSR Panther conductor having length

[B1] LINE: GETCO/TR-II/TL/220kV/S&E/2512: Supply, Erection, Testing & Commissioning of LILO of one circuit of 220kV D/C BECL — Botad line at 220kV Vallabhipur S/S on D/C Tower with ACSR Zebra Conductor with OPGW cable having

[C] S/S: GETCO/TR-II/TL/220kV/S&E/2511: Supply, Erection, Testing & Commissioning of 220kV D/C Moti Gop - Babarzar Line on D/C Tower with AL-59 Conductor with OPGW Cable - 18.374 kM on turnkey basis under Kishan Suryoday Yojana [D] CIVIL: GETCO/CE (Proj.)/SE(C)/ TCN-38/ 20-21 / For Civil Works: (1) Civil Package Work for 66KV Goddha S/S Tal. Valod & Dist. Tapi under Navsari TR Circle (2) Civil Package Work for 66KV Sarigam GIDC Plastic Zone S/S Tal. Umargam 8 Dist. Valsad under Navsari TR Circle (3) New asphalt road and other ancillary work for laying of 66KV Narol-Ahmedabad DSS U/G cable (6+1) line in jurisdiction of AM under deposit scheme under Nadiad TR Circle.

Above Tender are available on web-site www.gseb.com & www.getcogujarat.cor (for view and download only) & https://getco.nprocure.com (For view, download ar

Note : Bidders are requested to be in touch with our website till opening of the Tende "Energy Saved is Energy Generated"

M.P. HOUSING & INFRASTRUCTURE DEVELOPMENT BOARD

Madhya Pradesh Housing & Infrastructure Development Board (MPHIDB) hereby invites online proposals though e-tender mode from reputed consultants for selection of consultants for preparation of feasibility Report 'DPR' Architectural Service Preparation of Tender document and bid process. Selection process would be as per RFP terms and conditions. Online bids are invited form interested bidders as per following details:

NOTICE INVITING TENDER

invited form interested bladere de per fellewing detaile .						
E-Tender No.	Name of Work	Cost of Tender Document	Earnest Money Deposit (EMD)			
2021_MPHID_ 139000 (1st Call)	Request for Proposal (RFP) for selection of consultant for preparation of DPR Architectural Services, Preparation of tender document & Bid process for construction & Development of Various project & miscellaneous work at Khurai Distt. Sagar (M.P.) approximately Project, cost Rs 10.00 Crore	Rs.10000/- (Ten thousand only)	Rs. 100000/- (One lakhs only)			

- Tender bid document can be purchased online by at www.mptenders.gov.in as per schedule, 22.04.2021 at 10:30 A.M. to 30.04.2021 at 05:30 P.M.
- 2. Interested bidders can view the detailed NIT on website www.mphousing.in and
- https://www.mpetenders.gov.in. 3. Key dates are available on e-tender website.
- 4. Amendments on NIT if any would be published on website only and not in newspapers.

Visit Us: www.mphousing.in E-mail: dhcsgrhb@mp.gov.in M.P. Madhyam/100598/2021

/mphidb

Chemcon Speciality Chemicals Limited

(AN ISO 9001:2015 and ISO 14001:2015 Certified Company)

DY. HOUSING COMMISSIONER Circle-Sagar, Mob. : 9425411263

(N.D. Ahirwar)

Regd. Office: Block No. 355, Manjusar Kunpad Road, Village: Manjusar, Taluka: Savli, Vadodara – 391775 Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: 0265 - 2981195 Statement of Deviation / Variation in utilization of funds raised in IPO Name of the listed Entity Chemcon Speciality Chemicals Limited Mode of Fund raising Public Issues / Rights Issues / Preferential Issues / QIP / Others September 29, 2020 (Allotment Date) Date of Raising funds Amount Raised INR 1650 Million (through Fresh Issue) Report filed for the Quarter ended December 31, 2020 Monitoring Agency Applicable / Not Applicable Monitoring Agency Name, if applicable HDFC B Is there a Deviation / Variation in use of funds raised Yes/No HDFC Bank Limited If ves, whether the same is pursuant to change in terms of a contract or objects, which was Not Applicable approved by the shareholders If yes, Date of shareholders Approval Explanation for the Deviation / Variation Comments of the Audit Committee after review Comments of the Auditors, if any No Objects for which funds have been raised and where 1. Capital expenditure towards expansion of there has been a deviation, in the following table Manufacturing Facility, 2. Funding working capital requirements 3. General corporate purposes. No deviation from the objects Original Modified Original Modified **Funds Amount of Deviation** Remarks

Not applicable as no deviation from the objects Deviation or variation could mean:

Object,

if any

Allocation

Object

Place: Vadodara

Date: 13-02-2021

(a) Deviation in the objects or purposes for which the funds have been raised; or

Allocation

if any

(b) Deviation in the amount of funds actually utilized as against what was originally disclosed; or (c) Change in terms of a contract referred to in the fund raising documents i.e, prospectus, letter of offer, etc

Utilised

For Chemcon Speciality Chemicals Limited

/ Variation for the

applicable object

quarter according to

Rajesh Gandhi

Chief Financial Officer

Saving SpiceJet: Ajay Singh faces his toughest test

With a series of default notices and sceptical banks, the promoter has a formidable challenge

ARINDAM MAJUMDER New Delhi, 15 April

arlier this week, Civil Aviation Secretary Pradeep Singh Kharola office to discuss what additional safety measures could be taken in view of the second wave of Covid-19.

While airlines made varied demands ranging from a bailout to stricter control over predatory pricing, the SpiceJet representative had an unusual suggestion: Curb capacity deployment to 60 per cent from the current 80 per cent, which was announced by the government a few weeks back.

The demand was unusual as airlines usually avoid regulatory control over what is purely a commercial decision as it hinders the ability of tweaking route networks to improve revenue.

Though a SpiceJet spokesperson denied there was any such demand, multiple airline executives confirmed that over the last few months, the airline had been pushing the government to further cut capacity. The reason for this is demand from aircraft lessors to ground planes over non-payment of lease rentals. "With less aircraft, the airline will bleed more as bigger rivals like IndiGo will pile on pressure," said a person aware of the development.

As on January 31, the airline had an active fleet of 81 aircraft including freighter planes as compared to more than 100 passenger aircraft in 2019.

The airline is facing grounding notice for 10 Boeing 737 aircraft while at least two lessors have pulled SpiceJet to court over non-payment of maintenance reserve on the grounded 737 Max aircraft. Grounding notices are served by lessors and financiers to airlines after multiple defaults on payments. A person aware of the developments said DAE Aerospace, BBAM have served grounding notice to SpiceJet.

While both the lessors had renegotiated payment and allowed a longer repayment period post the pandemic and after SpiceJet assured them that payment will be on time from FY22. But with no payment coming, they are getting impatient. Both the lessors have asked the airline to park the aircraft at GMR group's MRO facility at Hyderabad and Air Work MRO's facility at Hosur. the person said.

The airline's spokesperson said that the airline was in talks with lessors to retain the aircraft and has succeeded in some cases while it has mutually agreed to return some as the lease term has expired.


While grounding notices are curable, this often signals the worsening metric and credibility of an airline among its creditors. SpiceJet had earlier faced grounding notices in 2014, when Ajay Singh, the current promoter rescued it ating old aircraft with business class seats. PBH, SpiceJet intends to pay lessors only Sun Group promoter Kalanithi Maran.

That fairy tale turnaround story has however taken a few knocks after a second wave of the pandemic has brought a series of default notices and has posed the toughest test for the 55-year old Singh to save the airline he founded and sold to the Marans only to assume control later.

A senior executive of the company said that the airline continued to defer payments to creditors expecting nor-FY22, but the surge in Covid cases has pushed things in reverse gear and creditors like lessors and banks are now becoming impatient, "Payments were Covid and the present crisis has only

SHRINKING FINANCIAL HEADROOM


Historical trend in operating profit and interest liability on trailing 12-mth basis



NEGATIVE NETWORTH, HIGH DEBT

The historical trend in Spicejet networth & borrowings





Ajay Singh (pictured) is now holding rounds of discussions with private equity funds and lenders for bridge funding. But after burning their fingers with Jet, banks are cautious about increasing exposure to weak airlines

supposed to be current from first week of April but it's now impossible to do so. Moreover, with air traffic increasing across the world, lessors now have more opportunities to seize aircraft and position it with new airlines. Hence you see the default notices," the person said.

Analysts have been pointing this out for some time now. Despite two months of forced grounding, the company in the December quarter had shown a liability of ₹14,311 crore. It was only five percent higher than ₹13.574 crore during the same period of FY20 when the skies were clear.

"The company had prepared the accounts based on confidence that it will be able to negotiate settlements with creditors and will to have to pay those. However, there are material uncertainties on its ability to continue deferring its obligations and unwind them," an analyst at a domestic brokerage pointed out.

Two people in know of SpiceJet's business said that while Singh is credited for turning around the airline, he should also be blamed for the airline's current state. In 2018 while Jet Airways was shutting

up the company and get some of Jet's aircraft and prime air-Two people in the

know of SpiceJet's

business said that

while Singh is

port slots at Delhi, Mumbai. In two months, SpiceJet acquired 30 aircraft of Jet Airways which Singh felt credited for turning could compensate for the 737 Max aircraft which was grounded after two fatal accidents. **blamed for the** What he didn't take into airline's current account was the increased state of affairs

cost of maintenance of oper-

from the verge of bankruptcy, acquiring The maintenance cost for the company for hours the aircraft operate. Sources said went up by 44 per cent in FV20 against the year before.

"Multiple senior executives advised Singh to be very cautious about inducting so many eight to ten-year-old aircraft at such a short time. But he went ahead with it and maintenance cost shot up. Also Jet Airways plane had 168 seats, including 12 business class ones that were charged several times higher than the economy class. SpiceJet had no experience to market such seats and kept on incurring loss for malcy to return from the first quarter of at least two quarters," said the person quoted above.

Secondly, the company was in urgent need of capital infusion even prior to

accentuated the liquidity crunch. But Singh didn't agree to dilute his stake while investment bankers came with multiple offers of equity sale.

Singh is now holding rounds of discussions with private equity funds and lenders for bridge funding. But after burning their fingers with Jet Airways, banks are cautious about increasing exposure to weak airlines. "There is no question of giving more funds unless the promoter brings in equity. Except significant equity infusion, nothing will get triggered," a banker which has exposure to SpiceJet said.

Singh is also holding discussions to sell stake in the cargo handling arm SpiceXpress. While the company has successfully passed a resolution to separate cargo business as a wholly-owned subsidiary, the process has faced objections from banks. Lenders are unwilling to give no objection certificate as change in ownership of the cargo arm will severely impair the cash flow of the company and put loans of the banks in risk," a banker said.

In the absence of passenger business, the cargo arm has been able to bring sigdown, Sigh saw an opportunity to scale nificant cash flow for the company. In

> the December quarter, SpiceJet's logistic services raked in a profit of ₹215 crore while its passenger services lost ₹827 crore. Pushed by lessors to ground aircraft, the airline is

around the airline, he should also he looking to wet lease aircraft under power-by-hour (PBH) agreements. In contrast to the traditional method of paying monthly lease rentals, under

that the airline has been successful to negotiate such a deal with a Czech airline SmartWings.

An analyst tracking SpiceJet said that he is facing hard times fielding questions from investors on SpiceJet, as conventional metrics suggest that the airline by now should be insolvent. "It's very difficult to track such a company. But I am not that negative. Remember, lessors can never ground an airline, only banks can and neither the government, nor the banks would want a company to go bankrupt," the analyst says.

That seems to be the best bet for Singh who has a stellar reputation of convincing the government.

AVERAGE DAILY PASSENGERS

Airlines to post ₹10K-cr loss in FY22: CRISIL

Mumbai, 15 April

Lower domestic air traffic compared with pre-pandemic levels, together with high fuel prices, and only a gradual recovery in international operations would result in domestic airlines posting ₹9,500-₹10,000 crore net loss in FY22, according to a CRISIL report.

The loss is, however, expected to be 35-40 per cent lower than the projected loss in FY21, it said.

The second wave of Covid-19 pandemic has already traffic. Airlines are clubbing flights as booking volumes cent. On Tuesday domestic air months. traffic fell to 183,331 (first time under 200,000 since last November).

On Thursday, Mumbai airport announced consolidation February. of all operations at terminal 2 ing a few flights to T1. All domestic and international

especially in Mumbai and the first half of this fiscal is resulted in slowdown in air Delhi, which account for 36 likely to be 3.5-4 times higher per cent of overall air traffic is expected to stall the recov-second half should see good have slumped around 40 per ery seen over the past six In fact, daily domestic pas-

senger air traffic fell in April by over 15 per cent to around 235,000 compared to "Domestic traffic fell 85 per

(T2) barely a month after shift- cent in the first half of the last ternational operations in the financial year because of lockdowns and restrictions on flights in Mumbai will now operations. Despite the secoperate from T2 from April 21. ond wave-induced fresh A resurgence of Covid-19 curbs, which will temper

Jan on-year, on a low base. The

recovery in traffic, supported

by acceleration in the vacci-

nation drive and people grad-

ually taking to travel after pro-

longed stay at home," said

Gautam Shahi, director of

CRISIL Ratings.







head for them. The price, which remained low until November 2020, limiting their losses, has shot up 30 per cent since then. This will offset the benefits from some of the initiatives the carriers undertook to reduce cost - employee costs, rentals, etc. — last fiscal and which are being carried forward into the current fiscal.

A gradual recovery in in-Fluctuations in crude oil price, foreign exchange rates, second half of fiscal 2022 will prolonged impact of the secalso boost traffic. However, airond wave on domestic traffic lines have also seen their cost volume, and the pace of recovof operations spurt due to a ery in international travel, rise in the price of aviation turwhich is more lucrative, will be infections across the country recovery, domestic traffic in bine fuel (ATF), a key cost key monitorables, CRISIL said.